

# “ગુજરાતના ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરિયર્સની ભૂમિકા”

કુદરતીની લીલા અકળ છે, કુદરતી ભોપ આ દુનિયા પર અનેક રૂપે ઉતરી આવે છે. ક્યારેક અતિવૃષ્ટિરૂપે, ક્યારેક વાવાઝોડા રૂપે, ક્યારેક ભીષણ આગ રૂપે, તો ક્યારેક ભૂંધ રૂપે પરંતુ આ વખતે તો, કોરોના વાઈરસ.....

“હે વિશ્વ માનવ....તારું આ ગાંડપણ ક્યાં જઈને અટકશે ? ભાઈ થઈને તું ભાઈનો પિનાશ કરશે ?

છોડ આ ગાંડપણ અપનાવ શાણપણ, “જીવો ને જીવવદો નો પાઠ તું ભણ.....”

કવિએ વિશ્વયુદ્ધ વખતે માનવીના વિજ્ઞાનના દુરઉપયોગની ચિંતા વ્યક્ત કરી હતી, એનું જ એક સ્વરૂપ આજે મહામારી સ્વરૂપે દુનિયામાં માનવીઓ માટે સંકટ થઈને ઊભું છે. મહાસત્તા બનવાની ઘેલછામાં થઈ રહેલા પ્રયોગથી જાણે-અજાણે વાયરસ સ્વરૂપે એક આફત સાંપ્રત સમયમાં દુનિયા સામે આવીને ઊભી છે. ચીનના વુહાન શહેરમાંથી નીકળેલ (વાયરસ) કોરોના. વાઈરસ કીરીઝ-૨૦૧૯ એટલે કે કોવિડ-૧૯ અદ્ય સ્વરૂપે આપણા દેશ તેમજ રાજ્યમાં ફરી રહ્યો છે. તેનાથી આપણી સુરક્ષા માટે જે ચોક્કાઓ કામ કરી રહ્યા છે તેને આપણે “કોરોના વોરિયર્સ” કહીએ છીએ. મિત્રો આવા દુશ્મન સામે લડનારા યોદ્ધાઓ બીજા કોઈ નહિ, પરંતુ આપણા જ ભાઈઓ-બહેનો કોક્ટર્સ, પરિચારીકાઓ, હેલ્થ વર્કર્સ, આશા-બહેનો તથા સમગ્ર પોલીસ કિપાર્ટમેન્ટ તથા મિડીયા, સરકાર તથા તંત્રના માણસો પોતાના જીવનાં જોખમે કોરોના પેશન્ટોની સારવાર કરી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાથી બચવાનો કોઈ ઈલાજ કે દવા ન હોવાથી સંપૂર્ણ તાળાબંધી (લોકડાઉન) કરી દેશમાં લોકોને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે આપણે સૌએ આવા વોરિયર્સ વિશે જાણવું જોઈએ તથા તેમના કાર્યની ભૂમિકા સમજી તેમના કામની કદર કરી તેમનું મનોબળ વધારવા પ્રયત્નો કરવા જોઈએ.

ઘન્ય છે એ માતાને જેમણે આવા કર્તવ્યનિષ્ઠ રત્નો આપણને આપ્યા છે. આજના જમાનામાં તલવાર અને બોમ કરતા પણ ઘાતક બનેલા રોગને નાથવા માટે ખડેપગે ઊભા રહીને ટીમવર્ક કરે છે તે જોયા જેવું છે. લોકડાઉનને કારણે શહેરોમાં અને ગામડાઓમાં નવી-નવી સમસ્યાઓ ઊભી થઈ છે. જેને પહોંચી વળવા માટે આખા ગુજરાતમાં ગુજરાત પોલીસની ટીમ ડી.જી.પી. શિવાનંદ ઝા સર ના નેતૃત્વ હેઠળ રાત-દિવસ લોકોને ઘરમાં રાખીને બચાવવા માટે પ્રયત્ન કરે છે. તંત્રના તમામ કર્મચારીઓ સ્ત્રી-પુરુષો તેમને પણ કુટુંબની આગવી સમસ્યા છે. કોક્ટરોનો પણ પોતાનો આગવો પરિવાર છે. તેમ છતાં તેઓ પોતાની ફરજ પર કર્મચારીઓ પોતાના છ-છ માસના બાળકોને સાથે લઈ જઈને કામ કરે છે. તો કેટલાક બાળકોનું મોં માત્ર મોબાઈલ પર જ જોઈ શકે છે. અરે, શું વાત કરું એક પોલીસ ભાઈ તો પોતાના મોટાભાઈના મૃત્યુ પછી બીજા જ દિવસે હાજર થઈ ગયા હતા. એક મહિલા પોલીસ કર્મચારીએ તો પોતાની જાતે જ માસ્ક બનાવી પિતરણ કર્યું. કાચો અને વ્યવસ્થા જાળવવાની સાથે-સાથે કોઈ ત્રિમિક ભૂખે ન સૂવે તે માટે તેમણે ભોજનની વ્યવસ્થા પણ કરી, કૂટપાથ પર રહેલા બાળકોને જમાડ્યા, પોતાની જાતની પરવા કર્યા પિના તમામ કર્મચારીઓ આની સામે ઝડૂમી રહ્યા છે. લોકોને “સ્ટે હોમ, સેફ હોમ” સમજાવી રહ્યા છે.

કેટલીક જગ્યાએ સંઘર્ષનો સામનો કરવો પડે છે. પિયારતો કરો જેને બચાવવા પ્રયત્ન થાય છે એ જ પથ્થરમારો કરે છે. આમ, કરતા ઘણા બધા કર્મચારીઓ કોવિડ-૧૯ નો ભોગ બન્યા છે. કેટલાંક મૃત્યુ પણ પામ્યાં છે. બીજી તરફ કોક્ટરો અને આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે ઊભી રહીને આપણા આરોગ્ય સચિવ ડૉ. જયંતિ રવિ મેડમના નેતૃત્વ હેઠળ કાર્ય કરી રહ્યા છે. અરે એક કોક્ટર દંપતિ તો પોતાનું લગ્ન મોકૂફ રાખીને બંને જણાએ આ યુદ્ધમાં ઝંપલાવ્યું. કેટલાક લોકોએ તો ઘર પણ નથી જોયું ને ૨૦-૨૦ કલાક કામ કરે છે. દવા નથી તો પણ ઓછા સાધનો દ્વારા દર્દીનું મનોબળ વધારીને તેમને સાજા કરીને ઘરે મોકલે છે. કેટલાક દર્દીઓના મુખે સાંભળ્યું છે કે અમે તો મરવાના હતા પણ કોક્ટરે ભગવાન સ્વરૂપે આવીને બચાવી લીધા. આ ભયંકર આફતમાં લડાઈ લાંબી છે. ડરવાનું નથી પણ લડવાનું છે.

આ યુદ્ધમાં મિડીયાએ પણ એટલું જ અગત્યનું યોગદાન આપ્યું છે. અને મહત્વની ભૂમિકા નિભાવે છે. મિડીયા કર્મી તેમના જીવના જોખમે જે તે સ્થળની મુલાકાત લઈ આપણી સમક્ષ સાચી માહિતી રજૂ કરે છે. આપણા આરોગ્ય સચિવ પણ મિડીયા દ્વારા જ આપણને માહિતી પૂરી પાડે છે. ખરેખર મિડીયાએ ખૂબ જ અગત્યની ભૂમિકા નિભાવી છે. બીજી તરફ દેશના એન.સી.સી. કેડેટ્સ, એન.એસ.એસ. તથા સ્કાઉટ ગાઈડ જેવી સંસ્થાના સ્વયંસેવકો પણ પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા છે. આ યુદ્ધ ઘણું લાંબું છે. પણ જીતવાનું તો છે જ ! તેવા મક્કમ મનોબળથી શિક્ષકો પણ પ્રજાને સમજાવી અને પોતાની યથાયોગ્ય સેવા આપે છે.


આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તથા તેમની ટીમો પણ ૨૪x૭ કલાક કામ કરી રહી છે. લોકડાઉનના સમય દરમિયાન લોકોને મક્કમ અનાજ-પિતરણ ગેસ તથા આર્થિક મદદ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. ઘણા બધા દાતાઓએ પણ દાનનો ઘોષ વહેવડાવી સરકારને સાથ આપ્યો છે. ભારતે વિશ્વને હાઈડ્રોક્લિસકલોરોકવીન (એમસીકયુ) દવા આપીને મદદરૂપ થવા પ્રયત્ન કરેલ છે. પિટૅશમાં ફસાયેલા ભારતીય નાગરિકો તથા વિદ્યાર્થીઓને વતન પરત લાવ્યા છે. શ્રમિકોની સમસ્યા હોય, ખેડૂતોની સમસ્યા હોય, કારીગર વર્ગની સમસ્યા હોય, નાત-જાત, ધર્મના ભેદભાવ પિના બધી જ સમસ્યાનું નિવારણ કરવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા તેમની ટીમ ખડેપગે ઊભી રહી છે.

સાથે સાથે દેશની આર્મી, નેવી, એરફોર્સ ત્રણે પાંખો હોસ્પિટલોની સેવા ઊભી કરવામાં ઝડપથી કામ કરી રહી છે. ભારતીય રેલ્વેને પણ હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે. આપણા કોરોના વોરિયર્સનું મનોબળ વધારવા માટે ત્રણ તબક્કે કાર્યક્રમ યોજવામાં આવ્યા. જેમાં ઘરમાં જ રહીને લોકો તાલીઓથી, થાળી વગાડીને, શંખનાદ કરીને તેમનું મનોબળ વધાર્યું. બીજા તબક્કામાં ટીપ પ્રાગટ્ય દ્વારા તેમજ ત્રીજા તબક્કામાં તેમની ઉપર અપવર્ષા કરીને તેમનું આત્મ સન્માન તેમજ મનોબળ વધાર્યું છે.

મિત્રો, આપણા આ કોરોના વોરિયર્સ ખૂબ જ અગત્યની ભૂમિકા નિભાવી રહ્યા છે. આપણે ઘરમાં જ રહીને તેમને સાથ અને સહકાર આપવાનો કેટલીક જગ્યાએ કોક્ટરને તેમની સોસાયટીમાં આપવા નથી દેતા, તો કેટલાક પોલીસ કર્મચારીઓ ઉપર પથ્થરમારો કરે છે. આવા લોકોને મારી નાશ નાંતી છે કે, આપણે એમની મહત્વની ભૂમિકા સમજીએ અને તેમને પૂરેપૂરો સાથ સહકાર આપીએ. ‘જય જય ગરવી ગુજરાત’

# Stay Home....Safe Home # We salute Corona warriors - બારોટ તુલસીબેન વસંતકુમાર (બી.એસસી., સેમ-૫) રોલ નં. ૧૯૦

# સ્વચ્છતા અને કોરોના



આધુનિક ભારતની સૌથી ઘૂણાપાત્ર બાબતો જેમ કે, ગરીબી, ગોટાળા અને ગંદકી, અદારમી સદીથી શરૂ કરીને એકવીસમી સદી સુધીની માનવજાતની સફરમાં ઘણું બધું બદલાઈ ગયું છે. લગભગ દરેક ક્ષેત્રમાં આપણે પ્રગતિ કરી છે. ફક્ત ગંદકીની સમસ્યા ત્યાંની ત્યાં જ છે. આપણે જ્યાં ત્યાં ગંદકી કરીએ છીએ. અને ગમે ત્યાં કચરો પણ નાખીએ છીએ.

આથી શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા અનિવાર્ય છે. આપણે આંખ, કાન, નાક, ચામડી, વાળ, નખ, દાંત વગેરે અવયવોને સ્વચ્છ રાખવા જોઈએ. સ્નાન કરતી વખતે શરીરના બધા અંગોની સફાઈ કરવી જોઈએ. આપણા કપડા પણ સ્વચ્છ હોવા જોઈએ. સ્વચ્છ કપડા અને સ્વચ્છ શરીર આપણા મનને સ્વચ્છ રાખે છે. અને આપણે બીમારીના શિકાર ન બની શકીએ.

જાહેર આરોગ્ય માટે ઘર અને મહોલ્લાની નિયમિત સફાઈ થવી જરૂરી છે. આપણે આપણા ઘરના બારી-બારણાં, ફળિયું, છત, દીવાલ વગેરેની નિયમિત સાફ સફાઈ કરવી જોઈએ. ઘર સુંદર હોય અને તેમાં સુંદર રાચ રચીલું વસાચેલું હોય, પરંતુ તેની નિયમિત સાફ સફાઈ ન કરતા હોય તો તે સુંદર લાગતું નથી. ઘરની

આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ. જ્યાં ત્યાં ગંદકીના ઢગલાં થવા દેવા જોઈએ નહિ. કચરાના ઢગલામી દુર્ગંધ પ્રસારે છે. અને જેતુઓ ઉત્પન્ન થાય છે. તેનાથી રોચાળો ફેલાય છે.

આપણો દેશ ગામઠાઓનો બનેલો છે. લોકોમાં કેળવણીના અભાવે ઘણા ગામડામાં ગંદકીનો પાર હોતો નથી. લોકોના ઘરના આંગણામાંજ ઉકરઠા બની જાય છે. લોકો ખુલ્લામાં મુદરતી હાજતે જતા હોય છે. ત્યાં માખી અને મચ્છરનો બેસુમાર ઉપદ્રવ થાય છે. લોકો ગમે ત્યાં થૂંકે છે, અને જાહેર સ્થળોએ ગંદકી કરીએ છીએ. કચરાપેટી હોય, પરંતુ તેમાં કચરો નાંખવાની તરદી લેતા નથી. પરિણામે ગંદકી અને દુર્ગંધ ફેલાય છે. આપણે આપણી મુદેવો સુધારવી જોઈએ. જ્યાં સ્વચ્છતા હોય છે. ત્યાં પ્રભુનો વાસ હોય છે. સ્વચ્છતા રાખવાથી વાતાવરણ પવિત્ર રહે છે. સ્વચ્છતાને લીધે રોગચાળો ફેલાતો અટકે છે. જેવા કે મેલેરિયા, કોરોના, કોલેરા જેવા રોગો ફેલાતા અટકે છે.

સ્વચ્છતાની જવાબદારી ગામઠામાં પંચાયતની અને શહેરોમાં સુધારાઈની હોય છે. તેઓ પોતાની જવાબદારી પણ નિભાવે છે. અનેક કર્મચારીઓ, સફાઈ કામદારો સફાઈ જાળવવાના કામે લાગે છે. સફાઈની આ પ્રવૃત્તિમાં લોકોનો સહકાર પણ એટલો જ રૂરી છે. લોકોને જાગૃત કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. સ્વચ્છતા રાખવા માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. જેમ કે, ટીવીમાં પ્રસારણ, રેડિયોમાં સ્વચ્છતા અંગેના સમાચાર આપવા જોઈએ કે જેથી લોકોમાં જાગૃતતા આવી શકે.

અમુક દેશોમાં સ્વચ્છતા અંગે સરકાર અને પ્રજા ખૂબ જ સભાન અને જાગૃત હોય છે. ત્યાં ગંદકી જોવા મળતી નથી. માખી-મચ્છરનું તો નામો નિશાન પણ હોતુ નથી. અમેરિકામાં એકવાર ફળના કરંકિયામાંથી એક માખી મળી ત્યારે સમાચાર ટીવી પર પ્રસારિત થયા હતા. આ બનાવ અંગે લોકો તપાસ પણ કરવામાં આવી હતી. સ્વચ્છતા અને આરોગ્ય વિશે આવી જાગૃતિ હોય ત્યાં સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી થઈ શકે.

આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. સ્વચ્છતા રાખવાથી આપણાં તન અને મન તાજગી અનુભવે છે. સ્વચ્છતાને અંગે આપણી સરકારે પણ ઘણાં પગલાં લીધાં છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા “સ્વચ્છ ભારત અભિયાન” પ્રારંભનીય પગલું ગણી શકાય. સ્વચ્છ ભારત અભિયાન મોદી ૨ ઓક્ટોબર ૨૦૧૪ માં મહાત્મા ગાંધીની ૧૪૫ મી જયંતી પર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચાલુ થયેલું. ભારત સરકારનું એક સફાઈ અભિયાન છે.

“સ્વચ્છ ભારત મિશન”માં આપણે મોટીજીએ લોકોમાં મિશનમાં જાગૃતતા લાવવા જાતે ઝાકુ લઈને સાફ-સફાઈ કરી હતી. સ્વચ્છ ભારત મિશન માટે હેટલાક શૂનો નીચે મુજબ છે.

- સ્વચ્છતા મારી ફરજ, સ્વચ્છતા માટે અધિકાર....., સૌનો સાથ અને ગંદકીનો નાશ....., ગંદકી બતાવે દવાખાનાની સીડી....., સ્વચ્છતાને લાવો ગંદકીને લગાડો....., સ્વચ્છતા ત્યાં પ્રભુતા....., જે જગ્યાએ હશે ગંદકી ત્યાં નહી મળે બંદગી.....

સ્વચ્છ ભારત મિશનમાં આપણે, એક ઘર સાફ કરીએ તો એક શેરી સાફ થાય. એક શેરી સાફ કરીએ તો એક ગામ સાફ થાય. એક ગામ સાફ કરીએ તો એક જિલ્લો સાફ થાય. એક જિલ્લો સાફ કરીએ તો એક રાજ્ય સાફ થાય. એક રાજ્ય સાફ કરીએ તો એક દેશ સાફ થાય. તેથી કહી શકાય કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા.....

વિશ્વએ આજદિન સુધી ઘણા વાઈરસનો સામનો કર્યો છે. જેમ કે, ઈન્ફ્લુએન્સા, પ્લેગ, ઈબોલા, બર્ડફ્લૂ, સ્પાઈન ફ્લૂ વગેરે. આજે વિશ્વ એક ભયંકર વાઈરસનો સામનો કરી રહ્યું છે. તેનું નામ છે - કોરોના વાઈરસ, જેને કોવિડ-૧૯ પણ કહેવાય છે. ૨૧ મી સદીની સૌથી મોટી ખતરનામ બીમારી કોરોના વાઈરસ છે. કોરોના વાઈરસ એક જીવલેણ વાઈરસ છે. કોરોના એ સ્પર્શથી ફેલાતો રોગ છે. કોરોના વાઈરસની ઉત્પત્તિ ચીનમાં પુકાન નગરીમાંથી થઈ હતી. કોરોના વાઈરસ આઠારમાં રાજાના મુગટ (કાઉન) જેવો છે. ત્યારે કોરોના વાઈરસની હાજરી ધ્રિટનમાં કાર્યરત ચીની કોલેજર પૂન લીટે (૨૦૦૩) માં નોંધી હતી.

ચીનમાં પુકાન શહેરમાં એક માંસાહારી બજારમાંથી કીડીખાઉ મારફત કોરોના વાઈરસ ફેલાવાની શરૂઆત થઈ હતી. ફક્ત એક જ મહિનામાં આરણી કરોઠો લોકો મૃત્યુ પામ્યા છે. ધીરે ધીરે આ મહામારી આખા વિશ્વમાં ફેલાઈ ગઈ છે. ચીનની આ હાલત જોઈએ ને આપણા દેશના કોરોના વાઈરસની વાઈરસની હાજરી ધ્રિટનમાં કાર્યરત ચીની ચીને કોવિડ-૧૯ ને મહામારી ઘોષિત કરી હતી. કોરોના વાઈરસના કારણે લોકો સંક્રમિત થયા છે. કોરોના સ્પર્શ કરવાથી થાય છે. કોરોના વાઈરસના સ્પર્શથી પહેલેથી જ ચેતી ગયા હતા.

ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. જેમાં ૧૩૭ કરોડથી પણ વધારે લોકો રહે છે. જાન્યુઆરી મહિનામાં કોરોના ભારતમાં વાઈરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યાર બાદ દરેક શહેરમાં વાઈરસ ધીમે-ધીમે વધવા લાગ્યો હતો. કોરોનો વાઈરસ એક-બીજાના સ્પર્શથી અને ભીડભાડવાળી જગ્યાએથી પ્રસરે છે. તેના કારણે તે વાઈરસ વ્યક્તિને ૧૫ દિવસ પછી થતાં જોવા મળે છે. તે વાઈરસના લક્ષણો વ્યક્તિના શરીરમાં જોવા મળે છે.

કોરોના વાઈરસના લક્ષણો :- (૧) શરદી થવી (૨) તાપ આવવો (૩) શ્વાસ લેવામાં તકલીફ (૪) ઠંડી લાગવી (૫) માંસપેશીઓમાં દુ:ખો (૬) માથું દુ:ખવું (૭) સ્પાઈ અને ગંધનો અહેસાસ ન થતો (૮) ઉઘરસ આવવી.

કોરોના ચોક્કા એટલે કે ગુજરાતને કોરોના મહામારીમાંથી લોકોને બચાવવા પ્રયત્નો કરતા, જેમા ડોક્ટર્સ, નર્સો, પોલીસ, સફાઈ કર્મીનો સમાવેશ થાય છે. અને હા જે ઘરમાં બેસી સરકારના આદેશનું પાલન કરી આ સંક્રમણ અટકાવવામાં મદદ કરે છે, એ લોકો પણ કોરોના વોરિયર્સ આપણી સરકાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબએ ૨૨ માર્ચથી લોક ડાઉન જાહેર કર્યું હતું. લોકડાઉન થોડા સમય માટે જ છૂટ આપવામાં આવી હતી. વ્યક્તિઓ હરવા ફરવા પર નિયંત્રણ મૂક્યું હતું. એકબીજા સાથે બેસવા ઉઠવાનું પણ બંધ કરી દીધું. તહેવારો ઉજવવાનું મુશ્કેલ બન્યું, પ્રવાસો ઓછા પ્રમાણમાં જોવા મળે છે. વાઈરસના કારણે દરેક વસ્તુઓ ઉપર નિયંત્રણ જોવા મળે છે.

કોરોના વાઈરસથી બચવાના ઉપાયો :- (૧) હળદરવાળુ દૂધ પીવું (૨) લીલી શાકભાજી, ખાટા ફળ ખાવા જોઈએ. (૩) કાઠો બનાવી ને ચીંતણું જોઈએ. (૪) પોતાનું શરીર સ્વચ્છ રાખવું જોઈએ. (૫) પોતાના હાથ વારંવાર સાફ કરવા જોઈએ. (૬) મોઢા પર માર્ક પહેરવું જોઈએ. (૭) ભરમ અથવા દુશ્મણું પાણી પીવું જોઈએ. (૮) હાથ સેનેટાઈઝરથી સાફ કરવા જોઈએ.

કોરોના વાઈરસની રસી કે દવા તો આપણી પાસે નથી. ભારતમાં અત્યાર સુધી આ રસી કે દવા શોધાઈ નથી. પરંતુ કોરોના વાઈરસથી બચવાના ઉપાયો આપણી પાસે છે.

આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કોરોના વોરિયર્સ માટે પહેલીવાર તાળી અને થાળી વગડાવી, બીજીવાર રાતે નવ વાગે નવ મિનિટ સુધી ટીપ પ્રાગટ્ય કરાવ્યું, અને ત્રીજીવાર હેલીકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરાવી. સરકાર પણ જાણે જ છે કે, આ યુદ્ધ વોરિયર્સ સિવાય લડી શકાય તેમ નથી. ખેરખર મને પણ આ ચોક્કાઓને પંદન કરવાનું મન થાય છે.

કોરોના વોરિયર્સને સલામ કરવાનું મન એટલે થાય છે, કારણ કે તે પોતાની, પોતાના પરિવારના ખાવા-પીવાની ચિંતા કર્યા વગર અત્યારે દેશની સેવા કરી પોતાનું દશે પ્રત્યેનું ઋણ અદા કરી રહ્યા છે. મે જોયું છે કે, કોરોના વોરિયર્સ ડ્યૂટી પરથી જ્યારે ઘરે જાય છે ત્યારે પણ પરિવારના સભ્યોથી અલગ રહી જીવી રહ્યા છે. અને તન, મન, ધનથી આજે દેશ સેવામાં કામમાં લાગી ગયા છે.

“કરીના ચિંતા પરિવારની, ના ચિંતા દેની, ના ચિંતા ખાવા-પીવાની, ના સુવધાની, આંખમાં સપનું લીધું તેમણે દેશની જોવા આબાદ, ઘરની બહાનર નીકળી કરશો ના તેને બરબાદ.....”

આપણે સુપર હીરોને ફિલ્મોમાં તો જોઈએ છીએ, પણ અસલી ફિલ્મોમાં દુનિયાના અસલી સુપર હીરો તો કોરોના વોરિયર્સ જ છે. આપણા દેશ માટે સૌથી ખરાબ એ છે કે આપણી પાસે આની કોઈ દવા કે રસી નથી છતાં પણ આપણા ડોક્ટર્સ અને નર્સો કોરોના દર્દીઓને બચાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આખા વિશ્વના વૈજ્ઞાનિકો ચોવીસ કલાક કામ કરીને કોરોના વાઈરસની રસી શોધી રહ્યા છે. વૈજ્ઞાનિકો દિવસ રાત એક કરીને કોરોનાની રસી અને દવા શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આપણને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે વૈજ્ઞાનિકોને રસી અને દવા શોધવામાં જલ્દી સળફતા મળે.

કોરોના વાઈરસ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. બધા દેશોમાં ખૂબ કેસ વધી રહ્યા છે. કોરોના ના કારણે બધા બાળકોનું પણ નુકશાન થાય છે. તેમના ભણતર માટે નુકશાન થતું હોવાથી બાળકોને ઓનલાઈન ટીચીંગ આપવામાં આવે છે. કોરોના કારણે કેટલીક પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી હતી. કોરોના વાઈરસને કારણે સ્કૂલો, કોલેજો, સિનેમા ઘર બધું બંધ રાખવામાં આવ્યું છે. તેથી બાળકોની પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવામાં આવે છે.

“આજે મંદિરો બંધ છે, પણ ભગવાન દેખાય છે....મસ્જીદો બંધ પણ ખુદા દેખાય છે....”

કોરોના વાઈરસ માટે કપિતા.....,

સ્વચ્છ રહે ચે દેશ મેરા, લગે જર્હા મેં સબસે પ્યારા....

મિલજુલકર હમ કરે સફાઈ, ઇસી મે સબકી હૈ ભલાઈ....

કુડા ક્યારા ના સડક પે ડાલો, બિમારી કો તુમ ના પાલો.....

મિલકર હમ સબ પેડ લગાયે, પર્યાવરણ કો હરા ભરા બનાયે.....

જગ-મગ જગ-મગ સડકે ચમકે, દેશ હમારા દુનિયા મેં દમકે.....

આવો મિલકર હમ કસમ ચે ખાયે, સ્વચ્છતા કો સબ અપનાયે.....

સબ મિલકર ચે કરો ઇરાદા, સ્વચ્છ રહે ચે ભારત દેશ હમારા.....




આજે સોશિયલ મીડિયા પર પોલિસ અને ડોક્ટરો પર હુમલા થતા જોઈએ અને ખરેખર દુ:ખ થાય છે. ખરેખર આવા સંકટના સમયમાં કોરોના વોરિયર્સ આપણા માટે ભગવાન સાબિત થાય છે. તો એમના પર આપણે હુમલા ન જ કરવા જોઈએ. આપણે તેમનું કૂલોથી સ્વાગત કરવું જોઈએ એમનું માન સચવાય અને કોરોના રૂપી યુદ્ધમાં લડવા માટે તેમને પ્રોત્સાહન મળી રહે.

છેલ્લે એટલું જ કહીશ કે ઘરમાં રહે, અને સુરક્ષિત રહો અને કોરોના ચોક્કાઓને સપોર્ટ કરો..... (બી.એસ.સી. - સેમ-૩) રોલ નં. ૦૯




- તળપદા ભૂમિકા સી.

(બી.એસ.સી. - સેમ-૩) રોલ નં. ૦૯

# કોવિડ-૧૯ : ચિત્રપર્થા - ૨૦૨૦



# डोपिड-१९ : चित्रस्पर्धा - २०२०



# પેટલાદ કોલેજમાં વિદ્યાર્થીઓને આવકાર સમારોહ



આહા, ઠા. ૧૯  
શ્રી આર.કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, પેટલાદમાં સેન્ટ્રલ હોલ ખાતે બી.એસ.સી. સેમ ૧ ના વિદ્યાર્થીઓને આવકાર સમારોહ યોજાયો હતો. જેમાં ડીપ પ્રાન્સ્ટવ, કોલેજ માન અને પ્રાચીના સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ડિવિઝનલ ડ્રાઇવ કોલેજના વિવિધ શ્રેણીમાંની જાણકારી આપવામાં આવી હતી. બી.ડી. જોષીએ પીપીટી દ્વારા કોલેજમાં વર્ષ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિની જાણકારી આપી હતી. આગમના વર્ણના વિદ્યાર્થીઓ દ્વારા શ્રેણિક અનુભવો વર્ણવવામાં આવ્યા હતા. આભાર વિધિ પ્રથમપાલ મુખનખાઈ પારેખ દ્વારા કરી હતી. કોલેજના સેવક મિત્રો, ટેકનિકલ સ્ટાફ, ડિપાર્ટમેન્ટ હેડ સાથે મળી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

# આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, પેટલાદમાં "Student Induction-2019" કાર્યક્રમ યોજાયો



પેટલાદ એન્ટરપ્રાઇઝ દ્વારા આ આર.કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં બી.એસ.સી. સેમ ૧ના વિદ્યાર્થીઓને આવકાર સમારોહ યોજાયો હતો. જેમાં ડીપ પ્રાન્સ્ટવ, કોલેજ માન અને પ્રાચીના સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ડિવિઝનલ ડ્રાઇવ કોલેજના વિવિધ શ્રેણીમાંની જાણકારી આપવામાં આવી હતી. બી.ડી. જોષીએ પીપીટી દ્વારા કોલેજમાં વર્ષ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિની જાણકારી આપી હતી. આગમના વર્ણના વિદ્યાર્થીઓ દ્વારા શ્રેણિક અનુભવો વર્ણવવામાં આવ્યા હતા. આભાર વિધિ પ્રથમપાલ મુખનખાઈ પારેખ દ્વારા કરી હતી. કોલેજના સેવક મિત્રો, ટેકનિકલ સ્ટાફ, ડિપાર્ટમેન્ટ હેડ સાથે મળી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

તા. ૦૭/૦૧/૨૦૨૦ - મંગળવાર .... પેજ નં. ૨

# પેટલાદ ખાતે વિદ્યાર્થીઓ માટે "New Hroizon of IT's fro Young Generation" વિશે વ્યાખ્યાન યોજાયું

(તસવીર : ઝેનુલ શેખ, પેટલાદ)



પેટલાદ, તા. ૭  
તા. ૦૯ના દિવસે પેટલાદ એન્ટરપ્રાઇઝ દ્વારા આર.કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, પેટલાદ ખાતે વિદ્યાર્થીઓ માટે આજના યુગમાં કમ્પ્યુટર સૈને કારકીદની વિશાળ તકો વિશે માહિતી આપવા માટે

"New Hroizon of IT's fro Young Generation" વિષય પર તજજ્ઞ ડૉ. જાનેશ જાની દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. જેમાં બી.એસ.સી. ના વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમના ઉપયોગો, મહટીમિટિયા દ્વારા 2D-3D એનિમેશન, સોફ્ટવેર ડેવલોપિંગ, નેટવર્કિંગ, સાઈબર સુરક્ષા અને સિક્યુરિટી વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડૉ. ઝેનુલ શેખે ઉપસ્થિતિ વ્યક્ત કરી હતી.

# ઓલ ઇન્ડિયા વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી કક્ષાએ પેટલાદ કોલેજનું ગૌરવ



ઓલ ઇન્ડિયા વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી કક્ષાએ પેટલાદ કોલેજનું ગૌરવ વધારવા માટે આર.કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના શારીરિક શિક્ષક એન્ડ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ ડૉ. મહેન્દ્રસિંહ કે. મંડોરાના આગેવાન ડૉ. ઝેનુલ શેખે આગેવાનો સાથે મળીને ઇન્ટર યુનિવર્સિટી કક્ષાએ પેટલાદ કોલેજને ગૌરવ લાવવાનું હતું. આ બંને ખેલાડીઓને કોલેજ પરિવાર દ્વારા દરદીઓ તથા ડૉ. વી.એસ. જોષીએ અભિનંદન પાઠવ્યા હતા.

-૨૦૨૦ [www.sardargurjari.com](http://www.sardargurjari.com)

# જળ બિલાડીના સંરક્ષણ-સંશોધનના રીસર્ચ બદલ પેટલાદના અક્ષિત સુથારનું સન્માન

વિશ્વમાંથી ૭ લોકોની વિવિધ શ્રેણીમાં એવોર્ડ માટે પસંદગી થઇ હતી

આહા, ઠા. ૨  
આજે જિલ્લામાંથી વડેલી મહીસાગર સહિત રાજ્યની અન્ય નદીઓમાં વસતી જળ બિલાડી લુપ્ત થવાના આરોહોવાથી તેના સંરક્ષણ, સંરક્ષણ માટે જુગતવાળા વાઈલ્ડલાઈફ એસોસિએટ આિત સુથારે કરેલ કાર્યક્રમની તાજેતરમાં ન્યુયોર્કમાં યોજાયેલ વર્લ્ડવ્યાપક પ્રમુખ કચેરીમાં સમગ્ર વિશ્વમાંથી ૭૦૦ ડૉ. અક્ષિત વિવિધ વિષય અને શ્રેણીમાં પસંદગી કરવામાં આવી હતી. જેમાં રીસર્ચ ક્ષેત્રમાંથી પેટલાદના અક્ષિત સુથારની પસંદગી થવા સાથે તેઓને મુકે રિયાત ઇન્ટરનેશનલ ઓટર વર્લ્ડવ્યાપક ક્ષેત્રમાં ઓટર એવોર્ડ આપવામાં આવ્યા હતા.



શ્રેણીમાંથી પસંદગી થઈને આર.કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના શારીરિક શિક્ષક એન્ડ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ ડૉ. મહેન્દ્રસિંહ કે. મંડોરાના આગેવાન ડૉ. ઝેનુલ શેખે આગેવાનો સાથે મળીને ઇન્ટર યુનિવર્સિટી કક્ષાએ પેટલાદ કોલેજને ગૌરવ લાવવાનું હતું. આ બંને ખેલાડીઓને કોલેજ પરિવાર દ્વારા દરદીઓ તથા ડૉ. વી.એસ. જોષીએ અભિનંદન પાઠવ્યા હતા.

# પેટલાદ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનું ગૌરવ



# આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પેટલાદમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી



આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણીમાં આર.કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના શારીરિક શિક્ષક એન્ડ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ ડૉ. મહેન્દ્રસિંહ કે. મંડોરાના આગેવાન ડૉ. ઝેનુલ શેખે આગેવાનો સાથે મળીને ઇન્ટર યુનિવર્સિટી કક્ષાએ પેટલાદ કોલેજને ગૌરવ લાવવાનું હતું. આ બંને ખેલાડીઓને કોલેજ પરિવાર દ્વારા દરદીઓ તથા ડૉ. વી.એસ. જોષીએ અભિનંદન પાઠવ્યા હતા.



# પેટલાદ કોલેજમાં સ્વામી સચ્ચિદાનંદ હોલ (ઓડિટોરિયમ)નું ખાતમુહૂર્ત કરાયું



પેટલાદ, તા. ૨૦  
પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમ તા. ૧૯/૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કોલેજ કેમ્પસમાં સ્વામી સચ્ચિદાનંદ હોલનું ભૂમિપૂજન સ્વામીજીના હસ્તે કરવામાં આવ્યું હતું.  
આ પ્રસંગે સ્વામીજીએ આશીર્વાચન પાઠવતાં જણાવ્યું હતું કે પ્રાચીનકાલમાં વિદ્યાની વ્યાખ્યા મુક્તિ અપાવે અને જ્યારે વર્તમાન સમયમાં વિદ્યા સરકારી નોકરી અપાવે તો એ વિદ્યા સાચી વધુમાં સ્વામીજી એ જણાવ્યું હતું કે પેટલાદના જમાનામાં આજીવિકા ધરી સસ્તી હતી પણ હાલની

પરિસ્થિતિમાં આજીવિકા માટે ભારે પ્રયત્ન કરવા પડે છે. જીવન હોય કે સંસ્થા દરેકને સમયની સાથે ઘોડવું પડે છે ઘોડવાની સાથે ક્યારેક ઊંડવું પણ પડે છે જીવનમાં ક્યાંક ઊંડાશો તો જ વિકાસ કરી શકાશે. પરંતુ કોને કેહવાય કે સમસ્યાનું નિરાકરણ કરી આપે તેને પરંતુ કેહવાય તેવા ધણા ઉદાહરણો આપી સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમ આશીર્વાચન પાઠવ્યાં હતાં. ત્યારબાદ આ પ્રસંગે ઉપસ્થિત ટ્રસ્ટી દેવાંગભાઈ પટેલ (ઈંધોવાળા), અધ્યક્ષ મહેશભાઈ યાજ્ઞિક, ખોડાભાઈ એસ. પટેલ, કમલેશભાઈ પટેલ (શાહપુર), જયેશભાઈ શાહ વગેરેએ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું.

સમારંભમાં અધ્યક્ષ સ્વામી પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પ્રજેશભાઈ પરીખ, મુખ્ય મહેમાન તરીકે પુનમભાઈ મંગલભાઈ પટેલ (ભાટીએલ), અતિથિ વિશેષ કાંતિભાઈ પટેલ (સંતોકપુરા), અરવિંદભાઈ પટેલ (શાહપુર), વિક્રમભાઈ પટેલ (વગેરેદરા), જયશંકર આર.ત્રિવેદી, દિલીપભાઈ શાહ, પિયુષભાઈ શાહ સહિત ઘણાઓ અને મૂખ મોટી સંખ્યામાં શહેરના અમીનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઘણાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે પુરોગ્રામને અંતે આભારવિધિ કોલેજના આચાર્ય ડો. વિમલ જોષીએ કરી હતી.

## પેટલાદ કોલેજમાં કમ્પ્યુટર કારકિર્દી વર્કશોપ આયોજાવાનું



પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત એન્ડ સાયન્સ કોલેજ, પેટલાદ ખાતે વિદ્યાર્થીઓ માટે આજના યુગમાં કમ્પ્યુટર કોર્સ કારકિર્દી તકો વિશે માહિતી આપવા માટે "New Horizon of IT's for Young Generation" વિષયે તકજ્ઞ ડો. જ્ઞાનેશ જ્ઞાની દ્વારા આયોજાવાનું હતું. જેમાં બી એસ સી ના વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમના ઉપયોગો મળી શકે તેવા રસીડી-ડી એનિમેશન, સોફ્ટવેર ડેવલોપિંગ, નેટવર્કિંગ, સાઈબર કાર્બન અને સિક્યુરિટી વગેરે વિશે જ્ઞાની કરી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડો. વિમલ જોષીએ વિદ્યાર્થીઓ અને મહેમાનઓને આવકાર્યા હતા. કમ્પ્યુટર વિભાગના અધ્યાપક ડો. ઉદય વ્યાસે મહેમાનઓની પરિચય વિદ્યાથીઓને કરાવ્યો હતો. કમ્પ્યુટર વિભાગના અધ્યાપક શિતિજ્ઞા શાસ્ત્રીએ કમ્પ્યુટર વિષયના ઉપયોગ અને ટેકનિકલ માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમનું મંચાલન કમ્પ્યુટર વિભાગના અધ્યાપક સીતલ મુરમના અને દર્શના પંડ્યા તથા આભારવિધી કમ્પ્યુટર વિભાગના અધ્યાપિકા શ્રેયા દવેએ કરી હતી.

## પેટલાદ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ



પેટલાદ એજ્યુ. ટ્રસ્ટ સંચાલિત આર.કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય શોન દિન ઉજવાયો હતો. સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ સમૃદ્ધમાં વિવિધ શોનમાં કમ્પે હતા.

## પેટલાદ કોલેજમાં એસેમ્બલી લેન્ગવેજ પર વર્કશોપ

પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર.કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, પેટલાદ નાં કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટનાં ઉપક્રમે આચાર્ય ડો. વિમલ જોષીના અધ્યક્ષ સ્થાને રાજે કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટનાં ડો. ઉદય વ્યાસની ઉપસ્થિતિમાં વર્કશોપ યોજાયો હતો. જેમાં રીસોર્સર્સ પર્સન ટરીકે આઈ.એ.સી. કોલેજના પ્રો. સંજય મંડલિયા તેમજ પ્રો. આર.એચ. સાધુ ઉપસ્થિત રહ્યા હતા, તેઓએ કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓને માર્ગદર્શી પ્રોત્સાહન એન્ડ એસેમ્બલી લેન્ગેજ વિષય પર વડત્ત આપ્યું હતું.



## પેટલાદ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં "સંસ્કૃત સંભાષણ" વર્ગોની શરૂઆત

પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર.કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, પેટલાદના સંસ્કૃત વિભાગના ઉપક્રમે ઉપરોક્ત સંસ્કૃત સંભાષણ વર્ગોનું ઉદ્ઘાટન સમરંભ સરંભના આચાર્ય ડો. વિમલ જોષીના અધ્યક્ષ સ્થાને રાજે સંસ્કૃત પાઠશાળાના આચાર્ય રાજે સંસ્કૃતના આર.કે. ગુપ્તાના આગેવાની હેઠળ શરૂ કરાયું હતું. ડો. વિમલ જોષીએ સંસ્કૃત સંભાષણના વર્ગોની વિદ્યાર્થીઓ સ્ટેજપર ખેડવા એની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. રાજે વર્ગોની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.



### ચરોતરનો અવાજ

તા. ૨૦/૦૨/૨૦૨૦ - ગુરુવાર ..... પેજ નં. ૩

## પેટલાદ કોલેજમાં સ્વામી સચ્ચિદાનંદ હોલ (ઓડિટોરિયમ)નું ખાતમુહૂર્ત કરાયું

પેટલાદ, તા. ૨૦  
પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમ તા. ૧૯/૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કોલેજ કેમ્પસમાં સ્વામી સચ્ચિદાનંદ હોલનું ભૂમિપૂજન સ્વામીજીના હસ્તે કરવામાં આવ્યું હતું.  
આ પ્રસંગે સ્વામીજીએ આશીર્વાચન પાઠવતાં જણાવ્યું હતું કે પ્રાચીનકાલમાં વિદ્યાની વ્યાખ્યા મુક્તિ અપાવે અને જ્યારે વર્તમાન સમયમાં વિદ્યા સરકારી નોકરી અપાવે તો એ વિદ્યા સાચી વધુમાં સ્વામીજી એ જણાવ્યું હતું કે પેટલાદના જમાનામાં આજીવિકા ધરી સસ્તી હતી પણ હાલની પરિસ્થિતિમાં આજીવિકા માટે ભારે પ્રયત્ન કરવા પડે છે. જીવન હોય કે સંસ્થા દરેકને સમયની સાથે ઘોડવું પડે છે ઘોડવાની સાથે ક્યારેક ઊંડવું પણ પડે છે જીવનમાં ક્યાંક ઊંડાશો તો જ વિકાસ કરી શકાશે. પરંતુ કોને કેહવાય કે સમસ્યાનું નિરાકરણ કરી આપે તેને પરંતુ કેહવાય તેવા ધણા ઉદાહરણો આપી સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમ આશીર્વાચન પાઠવ્યાં હતાં. ત્યારબાદ આ પ્રસંગે ઉપસ્થિત ટ્રસ્ટી દેવાંગભાઈ પટેલ (ઈંધોવાળા), અધ્યક્ષ મહેશભાઈ યાજ્ઞિક, ખોડાભાઈ એસ. પટેલ, કમલેશભાઈ પટેલ (શાહપુર), જયેશભાઈ શાહ વગેરેએ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું.


સમારંભમાં અધ્યક્ષ સ્વામી પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પ્રજેશભાઈ પરીખ, મુખ્ય મહેમાન તરીકે પુનમભાઈ મંગલભાઈ પટેલ (ભાટીએલ), અતિથિ વિશેષ કાંતિભાઈ પટેલ (સંતોકપુરા), અરવિંદભાઈ પટેલ (શાહપુર), વિક્રમભાઈ પટેલ (વગેરેદરા), જયશંકર આર.ત્રિવેદી, દિલીપભાઈ શાહ, પિયુષભાઈ શાહ સહિત ઘણાઓ અને મૂખ મોટી સંખ્યામાં શહેરના અમીનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઘણાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે પુરોગ્રામને અંતે આભારવિધિ કોલેજના આચાર્ય ડો. વિમલ જોષીએ કરી હતી.

પેટલાદ એજ્યુ. ટ્રસ્ટ સંચાલિત આર.કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય શોન દિન ઉજવાયો હતો. સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ સમૃદ્ધમાં વિવિધ શોનમાં કમ્પે હતા.

૬૩-૬૪




૧૫ મી ઓગસ્ટ-૨૦૨૦  
સ્વાતંત્રતા દિવસની ઉજવણી



ભૂમિપૂજન - સ્વામી - શ્રી સચ્ચિદાનંદ ઓકિટોરિયમ



ભૂમિપૂજન - સ્વામી - શ્રી સચ્ચિદાનંદ ઓકિટોરિયમ



ઓનલાઇન સ્ટુડન્ટ ઇન્ડકશન પ્રોગ્રામ-૨૦૨૦



ઓનલાઇન સ્ટુડન્ટ ઇન્ડકશન પ્રોગ્રામ-૨૦૨૦

કેમ્પસ એમ્બેસેડરની મીટિંગ -  
મામલતદાર કચેરી, પેટલાદ.





ફી મારક વિતરણ N.S.S.



ફી મારક વિતરણ N.S.S.

વ્હાલા વાચકમિત્રો,

‘ઉત્થાન’ એ વિદ્યાર્થીઓનાં જોમ અને ઉત્સાહ-શક્તિ દ્વારા સમાજમાં ઊંચા શિખરો સર કરી, તેમનાં સ્પંદનોને સ્પર્શ કરતા મેગેઝિન તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. મેગેઝિનમાં લખેલા લેખ, કાવ્યો તથા અન્ય કૃતિઓ જે કંઈ તેઓએ સાંભળ્યું છે, વાંચ્યું છે કે વિચાર્યું છે તેને તેઓએ પોતાના શબ્દોમાં વ્યક્ત કરવા પ્રત્યનો કર્યા છે. આ ‘ઉત્થાન’ મેગેઝિન દ્વારા કવિઓ, લેખકો અને સાહિત્યકારોનો ઉછેર કરવાનું કામ થઈ રહ્યું છે. માટે વિદ્યાર્થીઓની જે કાંઈ ભૂલો છે તેને ક્ષમ્ય ગણી તેમને પ્રોત્સાહિત કરશો તેવી વાચક મિત્રો પાસેથી અપેક્ષા રાખીએ છીએ. વાંચનના અંતે આપના પ્રતિભાવ અમારા સરનામે અથવા  
Email ID - petladartsandscience@gmail.com મારફતે મોકલાવશો.

- સહતંત્રીશ્રી

(Printed Matter)

BOOK POST



To

From :

આચાર્યશ્રી

શ્રી આર. કે. પરીખ આર્ટ્સ એન્ડ

સાયન્સ કોલેજ, પેટલાદ.

બિ. આણંદ - ૩૮૮ ૪૫૦. ફોન : (૦૨૬૯૭) ૨૫૨૩૯૬

Email ID - petladartsandscience@gmail.com

વર્ષ : ૧૦

ઉત્થાન : પાન નં - ૨૦

અંક : ૬૨-૬૩-૬૪